https://archive.org/details/bk1388/page/n0/mode/1up

2012-11-14 -Satpanth -Protest against religious conversion -Gujarat Samachar (1388)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

...ળીના દિવસે મહાલક્ષ્મી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા હતાં. (તસ્વીરઃ હરેશ સોની)

પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપીને

જામનગરમાં મહિલાનું અપહરણ કરીને ભાણેજે ગુજારેલો બળાત્કાર

જામનગર, તા.૧૩

જામનગરના કિશાન ચોકમાં રહેતી મહિલાનું તેણીના જ ભાણેજે અપહરણ કરીને કારમાં લઈ જઈ અવારનવાર જુદા જુદા સ્થળોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.

ખરાબ કૃત્યના ત્રણ માસ બાદ મહિલાએ અરજી કરતા પોલીસે ફરિયાદ નોંધીને હાથ ધરેલી કાર્યવાહી

બનાવની મળતી માહિતી અનુસાર જામનગરના કિશાન ચોકમાં જોલીયા પીરની દરગાહ પાસે રહેતા શેરબાનુ નામની પરણીત મહિલા તેણીના પુત્ર સાથે તેના ઘર પાસેથી જતી હતી તે દરમ્યાન પ્રોલમાં રહેતો તેણીનો ભાણેજ અફઝલશા યાકુબશા શાહમદાર ફકીર નામનો શખ્સ મારૂતી કારમાં બેસાડી અપહરણ કરી ગયો હતો. બાદમાં મહિલાને પ્રોલમાં જુદા જુદા સ્થળોએ લઈ જઈ પુત્રને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. બનાવના ત્રણ માસ બાદ મહિલાએ તેણીના ભાણેજ અફઝલશા ફકીર વિરૂધ્ધ જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી. જેના આધારે પોલીસે અફઝલશા વિરૂધ્ધ અપહરણ અને બળાત્કારની ફરીયાદ નોંધી મહિલાને તબીબી પરિક્ષણ માટે હોસ્પીટલમાં મોકલી આરોપીની ધરપકડ માટેની તજવીજ આરંભી હતી.

સાવરકુંડલામાં આચારસંહિતાનો સરેઆમ ઉલાળીયો

કોંગ્રેસનાં અગ્રણીએ સ્નેહમિલન યોજીને કર્યા ચૂંટણીલક્ષી ભાષણો

અમરેલી, તા.૧૩

સાવરકુંડલાના એક કોંગી અગ્રણીએ બે દિવસ પહેલાં જ અહીંની પટેલવાડી ખાતે ખેતમજુર હિતરક્ષક સમિતિનાં નેજા તળે સ્નેહમિલન કાર્યક્રમ યોજી ચૂંટણીલક્ષી ભાષણો કરી જનમેદનીને સંબોધી આચારસંહિતાનો ઉલાળીયો કરી નાખતા ભાજપ છાવણીમાં સન્નાટો પ્રસરી જવા પામે છે અને અધીકારીઓ અંધારામાં રહી ગયાનું જાણવા મળેલ છે.

ખેતમજુર હિતરક્ષક સમિતિનાં ઓઠા તળે યોજાયેલા સમારોહથી અજાણ સ્થાનિક અધિકારીઓ પણ અંધારામાં રહી ગયા

સાવરકુંડલાના પીઠવડીના ઉદ્યોગપતિ અને પૂર્વ ધારાસભ્ય સ્વ. મનુભાઇ પીઠવડીવાળાનાં ભત્રીજા દકુભાઇ બાલધા આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પ્રબળ દાવેદાર મનાઇ રહ્યા છે, ત્યારે આ કોંગી અગ્રણીએ દિપાવલીના તહેવાર નિમિત્તે સાવરકુંડલાની પટેલવાડી ખાતે ખેતમજુર હિતરક્ષક સમિતિનાં નેજા તળે વિરાટ સ્નેહમિલન બોલાવેલું અને સેંકડો લોકોએ ભોજન લીધું હતું. આ સ્નેહમિલનના નેજા તળે ચૂંટણીલક્ષી ભાષણો કરી જનમેદનીને સંબોધવામાં આવી હતી અને તાજેતરમાં ભાજપના ધારાસભ્ય કાળુભાઇ વિરાણી સાથે તેની સગી દિકરીએ કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસની માંગ કરવામાં આવી હતી. ભાજપનું દેવાળુ કાઢવાની વાત કરી હતી. આ તમામ ઘટનાઓથી સ્થાનિક અધિકારીઓ અંધારામાં રહ્યા હતા અને ભાજપ છાવણીમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.

અમદાવાદ નજીકના પિરાણા સ્થિત

સતપંથ સંસ્થાનમાં ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ સામે આક્રોશ

જૂનાગઢ,તા.૧૩

અમદાવાદ નજીકના પિરાણા સ્થિત સતપંથ સનાતન સંસ્થાન પ્રેરણાપીઠનાં સાનિધ્યમાં હિન્દુ ધર્મ વિરૂધ્ધ ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ હિન્દુ ધર્મનાં નામો પર પ્રપંચ થઈ રહ્યો હોવાનો આક્ષેપ ભારત સાધુ સમાજે કર્યો છે. આગામી સમયમાં અહીં યોજાનારા સંત સંમેલનમાં કોઈ સાધુ-સંતોએ ભાગ ન લેવા આહવાન કરાયું છે.

આગામી સમયમાં યોજાનાર સંત સંમેલનમાં કોઈ સાધુ સંતોએ ભાગ ન લેવા ભારત સાધુ સમાજનું આહ્વાન

આ અંગે ભારત સાધુ સમાજનાં પ્રમુખ ગોપાલાનંદજીબાપુએ જણાવ્યું છે કે, ઘણા વર્ષોથી સતપંથ ધર્મનાં પ્રચારકો હિન્દુ સંસ્કૃતિના નામ આચાર તેમજ હિન્દુ ધર્મના સાહિત્યનાં ઉપયોગ કરી સમગ્ર હિન્દુ સમાજને ભુમિત કરી ઈસ્લામ ધર્મ સ્વીકાર કરવાની છેતરામણી પ્રવૃત્તી કરી રહ્યાં છે. અને ભોળીપ્રજા આ કચકચથી પ્રભાવિત થઈ રહી છે. સતપંથનાં કુચક્રનો વિરોધ કરવા વાળા સંતોથી બચવા અને હિન્દુ સમાજનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે સમયે સમય પર હિંદુ સંમેલન પણ બોલાવે છે. આવા પ્રભાવથી પિરાણાજતા લોકોને ખબર પડતી નથી કે આ સતપંથ સંસ્થા હિન્દુની છે કે, મુસલમાનની? આવી ભ્રામક જાળ પથરાયેલી છે. આગામી તા.૧૭,૧૮, અને ૧૯ના પિરાણા ખાતે દેશભરનાં પ્રતિષ્ઠીત સાધુ સંતોનું સંમેલન યોજાનાર છે. તેમાં સાધુ સંતોએ ન જવા ભારત સાધુ સંતોને ભારત સાધુ સમાજે ચિમકી આપી છે.

જૂનાગઢમાં દિવાળીના પાવન દિવસે મહાલક્ષ્મી મંદિરે ભકતોની ભીડ

જૂનાગઢ, તા. ૧૩

જૂનાગઢમાં આજે દિવાળી નિમિત્તે મહાલક્ષ્મી મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં અને વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો લાગી હતી.

વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે લાગેલી ભાવિકોની લાંબી કતારો

જૂનાગઢમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવા, રંગોળી કરવી એ ઉપરાંત શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી માતાજીના દર્શન કરવાનું આગવું મહત્વ છે. આજે દિવાળી નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા અને છેક સાંજ સુધી ભાવિકોનો પ્રવાહ અવિરત મંદિર તરફ વહેતો રહ્યો હતો. માતાજીના દર્શન માટે લોકોની લાંબી કતારો લાગી હતી. મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડતા પંચહાટડી ચોક, મહાલક્ષ્મી સ્ટ્રીટ, દાણાપીઠ, ઢાલરોડ સહિતના વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી હતી. આમ આજે હજારો ભાવિકોએ મહાલક્ષ્મી માતાજીના દર્શન કરી ધન્યતાનો અહેસાસ વ્યકત કર્યો હતો.

જામનગરમાં દારૂનો જથ્થો લઈને નીકળેલા

સસ્પેન્ડ પોલીસમેનને પકડવા જતાં ફોજદાર કાર સાથે ૩૦ ફૂટ ઢસડાયા

જામનગર,તા.૧૩

જામનગરમાં દારૂનો જથ્થો લઈને નીકળેલા સસ્પેન્ડ પોલીસમેનને પકડવા જતાં ફોજદાર કાર સાથે ૩૦ ફૂટ સુધી ઢસડાયા હતા અને ઈજા પહોંચી હતી. ફિલ્મીઢબે તેમણે બુટલેગર પોલીસમેની કારનું સ્ટયરીંગ પકડી રાખ્યું હતું. જો કે એ પોલીસમેન નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

ફિલ્મી ઢબે કારનું સ્ટીયરીંગ પકડી રાખનાર ફોજદાર ઘાયલ, બુટલેગર પોલીસમેન નાસી છૂટવામાં સફળ

આ અંગેની મળતી માહિતી મુજબ, જામનગરના ગ્રામ્ય ડીવાય.એસ.પી. કચેરીમાં રીડર પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા જી.એન.વાઘેલા સોમવારાં રાત્રીનાં સમયે બિરલ બાગ પાસે પેટ્રોલંગમાં ફરજ પર હતા. ત્યારે ભારે શંકાસ્પદ કાર પસાર થતાં આંતરી પુછપરછ કરતા ચાલક દિગુભા જાડેજા અને દારૂનાં કેસમાં પોલીસ વિભાગમાંથી સસ્પેન્ડ કરાયા હોવાનું જણાવ્યું હતું. પી.એસ.આઈ.ને શંકા જતા કારમાં દારૂનો જથ્થો હોવાથી કાર પોલીસ મથકે લેવાનું જણાવતા ચાલક દિગુભા એ બોલાચાલી કરી હતી અને પી.એસ.આઈ. વાઘેલાએ કારનું સ્ટીયરીંગ પ કડી રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાર હંકારી મુકી હતી.

જેથીસ્ટયીરીંગ પકડેલા પી.એસ.આઈ. વાઘેલા કારમાં ત્રીસ ફુટ સુધી ઢસડાયા હતા અને બાદમાં ઢસડાયેલા પી.એસ.આઈ.ને ઈજા પહોંચતા કાર ચાલક દિગુભા જાડેજા કાર લઈ નાસી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્તે કંટ્રોલમાં જાણ કરી હતી .અને બાદમાં તેને અહીની સરકારી હોસ્પીટલમં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણે સસ્પેન્ડ પોલીસ કર્મી દિગુભા જાડેજા વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને ઈજા પહોંચાડયાની ફરીયાદ નોંધાવી છે. દિગુભા વિરૂધ્ધ દારૂના અનેક કેસો છે. તેમજ પાસામાં પણ અટકાયત થઈ હતી. પોલીસે દિગુભાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.

ઉનાના કંસાટી નજીક ત્રિપલ અકસ્માતમાં ૧૧ વ્યક્તિને ઈજા

ઉના,તા.૧૩

ઉનાના કંસાટી ગામ પાસે છકડા રીક્ષા સાથે મોટરસાયકલ અથડાતા સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ૧૧ વ્યક્તિઓને નાની મોટી ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયાં હતાં.

મજૂરોને ભરીને આવી રહેલી છકડો રિક્ષા સાથે બે મોટર સાયકલો અથડાતા સર્જાયેલી દુર્ઘટનાં

ઉના શહેરથી કંસારા ગામ જતા રોડ ઉપર ઉના તાલુકાનાં ભાચા ગામનાં અશ્વિન રામજીભાઈ કુંભાર ડાંગોદરા તેમની પત્ની સંગીતાબેન, ભારતીબેન સામતભાઈ ડોગોદરા સાથે ઉનાથી દિવાળી સબબ ખરીદી કરી પરત ત્રિપલ સવારીમાં જતા હતા ત્યારે સામેથી ધોકડવા તરફથી મજુરોને નાથળ મુકવા જતી છકડો રીક્ષા સાથે ધડાકા ભેર અથડાતાં ત્રિપલ સવારી વાળું મોટર સાયકલ રોડ ઉપર ફંગોળાઈ પડતાં બીજી બાઈક જતી હતી તેની સાથે અથડાતા તે પણ પડી ગયું હતું. ઘડીક વારમાં રોડ ચીસા ચીસથી ગાજી ઉઠયો હતો. જેમાં ઈજા પામનાર દયાબેન કરશનભાઈ રૂપાબેન કરશનભાઈ, મયુરીબેન જીતુભાઈ રે. ભાચા ત્થા છકડા રીક્ષામાં બેઠેલા શ્રીમીક મનીષાબેન કાનાભાઈ (રે. સીલોજ) દિપાબેન ભાણાભાઈ નાનજીભાણાભાઈ નયનાબેન સાર્દુલ (મોટા ડેસર) ત્થા સપના બ`ન સાર્દુલભાઈ (રે. નાથળ) સહિત અગીયાર જણાને ઈજાઓ થતાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ઉના દવાખાને સારવાર માટે ખસેડયાં હતાં. જેમાં અશ્વીનભાઈ ડાંગોદરા, રૂપાબેન બે દવાખાના સ્થીત ગંભીર હોય વધુ સારવાર માટે જુનાગઢ ખસેડેલ છે.

વાહનોની ઝડપથી ઉત્પન્ન કૃત્રિમ પવનમાંથી થતું વીજ ઉત્પાદન

જૂનાગઢ, તા. ૧૩

તાજેતરમાં જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ પીટીસી ઝોન કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં જૂનાગઢની એક પીટીસી કોલેજની તાલીમાર્થીઓએ રસ્તા પર પસાર થતાં વાહનોની ઝડપથી ઉત્પન્ન કૃત્રિમ પવનમાંથી વીજ ઉત્પાદન તેનો ઉપયોગ અને ફાયદાની કૃતિ રજૂ કરી હતી જે જિલ્લા કક્ષાએ પ્રથમ આવી હતી. હવે રાજય કક્ષાએ ભાગ લેશે.

જૂનાગઢની વિજ્ઞાન મેળાની કૃતિ રાજય કક્ષાએ પહોંચી

જીસીઈઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢના ઉપક્રમે જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ પીટીસી ઝોન કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત મહિલા પીટીસી કોલેજના તાલીમાર્થી મૌસમી ગરેનીયા અને રાજલબે ભમ્મર અને ભાવનાબેન વસરાએ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા રવજીભાઈ પીઠવાના માર્ગદર્શન હેઠળ રસ્તા પર પસાર થતાં વાહનોની ઝડપનાં લીધે વેગથી ઉત્પન્ન થતાં કૃત્રિમ પવનમાંથી વીજ ઉત્પાદન, ઉપયોગ અને તેના ફાયદા અંગેની કૃતિ રજૂ કરી હતી જે કૃતિ પ્રથમ સ્થાને પહોંચી હતી. હવે આ કૃતિ આગામી રાજય કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે.

સીમાંકનના કારણે ભાજપના ફળદુથી કોંગ્રેસના ઉંધાડની બેઠકો વિલીન

સૌરાષ્ટ્ર-કચ્છમાં સીમાંકનથી બદલાતા રાજકીય સમીકરણઃ આઠ બેઠકો રદ

રાજકોટ, મંગળવાર

સૌરાષ્ટ્ર-કચ્છમાં સીમાંકનને કારણે ભૌગોલિકની સાથોસાથ રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાઇ ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ફળદુથી લઇને કોંગ્રેસના બાવકુભાઇ ઊંધાડ માટે આ ચૂંટણીમાં ઉમેદવારી કયાં નોંધાવવી તે પ્રશ્ન સર્જાયો છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં વિધાનસભાની ૫૮ બેઠકો હતી, જેમાં નવા સીમાંકનથી ૮ બેઠકો વિલીન થઇ છે, જ્યારે ૪ નવી બેઠકો સર્જાતા કુલ ૫૪ બેઠકો છે.

રદ થયેલી બેઠકો કોણ જીત્યુ હતુ?

હળવદ	ભાજપ	માળિયાહાટિના	ભાજપ
ભાણવડ	ભાજપ	બાબરા	કોંગ્રેસ
પ્રોલ-જોડીયા	કોંગ્રેસ	મુન્દ્રા	ભાજપ
ઉપલેટા	ભાજપ	ઘોઘા	ભાજપ

સીમાંકનની સર્વાધિક અસર જામનગર જિલ્લામાં થઇ છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુની બેઠક કાલાવડ આગામી ચૂંટણીમાં અનામત જાહેર થતા ફળદુ માટે મુંઝવણ સર્જાઇ છે.

જામનગર જીલ્લામાં ૨૦૦૭ની ચૂંટણીમાં જામનગર, જામનગર ગ્રામ્ય, ભાણવડ, પ્રોલ, જોડિયા, કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, દ્વારકા બેઠકો હતી. તેમાં નવા સીમાંકન બાદ ભાણવડ અને પ્રોલ-જોડિયાની બેઠકો ઘટી છે તેની સામે જામનગર શહેરમાં એક બેઠક વધતા શહેરની ત્રણ બેઠક થઇ છે. જીલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય મુળુભાઇ બેરા અને રાજય મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી જેવા ઉમેદવારોની ક્ષમતા કસોટીની એરણ પર છે.

કચ્છમાં મુન્દ્રા બેઠક ભાજપનો ગઢ ગણાય છે, ૧૫ વર્ષથી આ બેઠક ભાજપ પાસે છે. મુન્દ્રા અનામત બેઠક હતી જે હવે માંડવીમાં ભળી જતાં અહીં ભાજપ અને કોંગ્રેસ બંને માટે નવા સમીકરણો સર્જાયા છે. આગામી ચૂંટણીમાં ગાંધીધામ (અનામત) નવી બેઠક જાહેર થઇ છે. અગાઉ આ વિસ્તાર અંજારનો હિસ્સો હતો. ગાંધીધામ અનામત જાહેર થતાં મુળ ગાંધીધામના અને અંજાર બેઠક ઉપરથી જીતેલા ભાજપના ધારાસભ્ય નિમાબેન આચાર્ય માટે જબરી વિમાસણ સર્જાઇ છે. ગયા વખતે ભૂજમાંથી જીતેલા મંત્રી વાસણભાઇ આહીરની

નજર આ વખતે તેના હોમ ટાઉન અંજાર ઉપર છે, ત્યારે કોંગ્રેસ પણ નવી સ્થિતિમાં નવી ગણતરી માંડી રહી છે. અમરેલી જિલ્લામાં કોંગ્રેસ હસ્તકની એકમાત્ર બેઠક બાબરા આ વખતે સીમાંકનમાં વિલીન થઇ ગઇ છે. બાબરા, વડીયા અને કુંકાવાવ વિસ્તાર ધરાવતી અને તેનો પહેલો પહેલો અક્ષર લો તો બા-વ-કુ થાય એ સંયોગ ગણો તો આ બેઠક કોંગ્રેસના બાવકુભાઇ ઊંધાડે જીતેલી હતી. હવે બાબરા બેઠકનો સમાવેશ લાઠીમાં થઇ ગયો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને માટે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. ૫૫ હજાર મતદારોનો ઉમેરો થયો છે. જેમાં અસરકારક ગણાય તેવા ૪૮ હજાર લેઉવા પટેલ મતદારો છે, જેને કેશુભાઇનું ફેકટર પણ અસર કરી શકે તેમ છે. કોંગ્રેસ અમરેલીમાં

સૌરાષ્ટ્રઃ રાજકારણને બદલાવતી ભૂગોળ

બાવકુભાઇને લડાવવા માગતી હતી પરંતુ છેલ્લી સ્થિતિ મુજબ લાઠી બેઠક ઉપરથી જ તેને લડાવાશે જ્યારે ભાજપમાં હજુ વર્તમાન ધારાસભ્ય સહિત ત્રણેક દાવેદારો છે.

સૌરાષ્ટ્રમાં સોરઠ ઉપર કોંગ્રેસની સર્વાધિક પક્કડ ગણાય છે. અહીં ૯માંથી ૩ બેઠકો કોંગ્રેસને મળેલી છે. આગામી ચૂંટણીમાં ભાજપના ગઢ જેવી માળિયા હાટીના બેઠક રદ થઇ છે અને આ બેઠકનો મોટો હિસ્સો માંગરોળ બેઠકમાં ભળ્યો છે. માંગરોળ બેઠક ઉપર ભાજપને માત્ર ૩ હજાર મતની લીડ મળી હતી.

કોળી અને મુસ્લિમ મતદારોની નિર્ણાયક ૭૦ હજારથી વધુની સંખ્યા ધરાવતા માંગરોળની પાલિકામાં કોંગ્રેસનું શાસન છે. તાલુકા પંચાયતમાં પણ ભાજપ એકાદ બેઠકના વધારા સાથે હાલકડોલક છે ત્યારે નવા પરિબળોના આધારે ઉમેદવારી અંગે ગણતરી મંડાઇ રહી છે. અહીં મતદારોનો ઝોંક હંમેશા અકળ રહે છે. છેલ્લી પાંચ ચૂંટણીમાં ૩ વખત કોંગ્રેસ, ૨ વખત ભાજપની જીત થઇ છે.

પાંચ હજારથી પણ ઓછી સરસાઇથી ૨૦૦૭માં ભાજપે જીતેલી ઉપલેટા બેઠક આ વખતે રદ થઇ છે. આ બેઠક ગત ચૂંટણીમાં

જિલ્લો	જીલ્લામાં રદ થયેલી બેઠક	જીલ્લામાં નવી બેઠકો
જામનગર	ભાણવડ-પ્રોલ-જોડીયા	જામનગર ગ્રામ્ય
રાજકોટ	ઉપલેટા	રાજકોટની ૧માંથી ૨ બેઠક
જૂનાગઢ	માળિયા(હા)	
અમરેલી	બાબરા	
સુરેન્દ્રનગર	હળવદ	
કચ્છ	મુન્દ્રા	ગાંધીધામ (અનામત)
ભાવનગર	ઘોઘા	ભાવનગર ગ્રામ્ય
પોરબંદર	-	-

એનસીપીના જમનાદાસ ગેડીયા લડયા હતા જેને ૩૨ હજારથી વધુ મતો મળ્યા હતાં. જુના સીમાંકન પ્રમાણે ઉપલેટાની બેઠકમાં તાલુકાના બાવન ગામ અને ધોરાજી તાલુકાના અગીયાર ગામોના એક લાખ ચાલીશ હજાર જેવા મતદારોમાં મુખ્ય જ્ઞાતિઓ જેવી કે કડવા પટેલ ૨૪૦૦૦ લેઉઆ પટેલ, ૧૮૦૦૦ આહેર ૧૫૦૦૦ મુસ્લીમ, ૧૫૦૦૦ દલીતો, ૧૨૦૦૦ કોળી ૧૦૦૦૦, રબારી ૬૦૦૦ ક્ષત્રીય ૬૦૦૦ અને બાકીના ઈતર મતો હતા. નવા સીમાંકનમાં પણ લેઉઆ અને કડવા બેમુખ્ય જ્ઞાતિના મતોનું મોટાપાયે ધૃવિકરણ થશે ત્યારે મુસ્લીમોના ૩૫૦૦૦ અને દલીતોના ૨૮૦૦૦ જેવા મતો અને ઈતર સમાજના મતો નિર્ણાયક સાબીત થશે. ઝાલાવાડ (સુરેન્દ્રનગર જિલ્લા)માં આ વખતે હળવદ બેઠકનો અડધો ભાગ ચોટીલામાં અને અડધો ભાગ ધ્રાંગધ્રામાં વિલીન કરી દેવાયો છે જેના કારણે હળવદના વર્તમાન ધારાસભ્ય દેવજીભાઇ ફતેપરાને બીજી બેઠક શોધવાની નોબત આવી છે. નવા સીમાંકનથી જ્ઞાતિના સમીકરણો બદલાઇ ગયા છે.

ભાજપની જીતેલી ૬ અને કોંગ્રેસે જીતેલી ૨ બેઠકો વિલીન થઇ: નવી ચાર બેઠકો સાથે જ્ઞાતિના સમીકરણોમાં પણ ફેરફાર

કુચિયાદડ પાસે કાર હડફેટે બાઈક ચાલક પ્રૌઢનું મોત

રાજકોટ, મંગળવાર

રાજકોટ નજીક કુચિયાદઢ ગામે પહેલાં કારખાનાં પાછળથી ગામ તરફ જતાં રસ્તે આજે બપોરે બાઈક લઈને વી રહેલા વલ્લભભાઈ જેઠાભાઈ દેસાઈ(૫૦, રહે. કુચિયાદડ) નામનાં પટેલ ગૃહસ્થને સામેથી આવતી વેગન-આર કારનાં ચાલકે હડફેટમાં લેતાં ગંભીર ઈજાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

ચોરડીના વસંતબા ગુરૂ આશ્રમમાં કાલે સમાધિ મંદિર સમારોહ

રાજકોટ, મંગળવાર

ગોંડલ પાસેનાં ચોરડી ગામે આવેલા વસંતબા ગુરૂ આશ્રમમાં તા.૧૫.૧૧ ગુરૂવારનાં રોજ અહીના બ્રહ્મલીન સંત જશુરામ મહારાજના ચેતન સમાધી મંદિર બાંધકામ પુર્ણ થતા ગુરૂમાતા પુ. વસંતબા માતાજી, તથા બંદરા આશ્રમના મહંત ગોરધનબાપા, તથા સતાધારથી વજિયબાપુ ગુરૂ બોદરા જીવરાજબાપુ વગેરેના હસ્તે દિપ પ્રાગટય કરી શાસ્ત્રોકત વિધિવત કરી ખુલ્લું મુકવામાં આવશે. તેમજ જસવંત જયોત પ્રકાશ ના સંતો ભકતોના સ્નેહમિલન નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

જૂનાગઢમાં ૨૦મીએ સિનીયર સિટીઝન મંડળની બેઠક

જૂનાગઢ,તા.૧૩

જૂનાગઢનાં સિનીયર સિટીઝન મંડળની માસિક મિટીંગ તથા નૂતનવર્ષ સ્નેહમિલન આગામી તા.૨૦નાં સાંજે ૫ વાગ્યે, માંગનાથ રોડ, જૂનાગઢ ખાતે યોજાશે.

સંક્ષિપ્ત સમાચારો

પ્રભાસપાટણનાં વિશ્વકર્મા મંદિરે આજે અન્નકૂટ ઉત્સવ

વેરાવળઃ પ્રભાસપાટણમાં ગુર્જર સુતાર જ્ઞાતિ સંચાલિત શ્રી વિશ્વકર્મા મંદિરે તા.૧૪મીએ બુધવારે અન્નકૂટ ઉત્સવ યોજાશે.

જૂનાગઢમાં આજે બર્ડાઈ બ્રહ્મસમાજનું સ્નેહમિલન

જૂનાગઢઃ બર્ડાઈ બ્રહ્મસમાજ દ્વારા નૂતનવર્ષ નિમીતે તા. ૧૪ના સાંજે ૪થી ૬, જ્ઞાતીની વાડી ખાતે સમાજના ભાઈ-બહેનોનું સ્નેહમિલન યોજાશે. જેમાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

જૂનાગઢમાં સમસ્ત લેઉવા પટેલ સમાજનું સ્નેહમિલન

જૂનાગઢઃ મહાનગરમાં વસતા લેઉવા પટેલ સમાજનું નવા વર્ષનું સ્નેહમિલન તા.૧૪ના સવારે ૮.૩૦ વાગ્યે દોમડીયાવાડી ખાતે યોજાશે. જેમાં દરેક જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહેવા સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજ દોમડીયા વાડીના પ્રમુખ દ્વારા જણાવાયું છે.

વડીયા ગીરમાં કાલે કસુંબલ લોકડાયરો

માળીયા હાટીના તાલુકાના વડીયા ગીરમાં તા. ૧૫ને ભાઈબીજને ગુરૂવારે નવા પ્લોટ ખાતે રાત્રે ૯ કલાકે વડીયાના રામદેવપીર મહારાજ યુવક મંડળ તથા વડીયા ગામ સમસ્ત ગામ લોકોના સાથ સહકારથી કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

સમાચારો ટૂંકાણમાં

માલગાડી હેઠળ આવી જતાં ગોરડકાના વૃધ્ધનું મોત

અમરેલી, તા.૧૩

સાવરકુંડલામાં ગોરડકા ગામના અસ્થિર મગજના વૃધ્ધનું ગુડઝ ટ્રેન હડફેટે આવી મોત નિપજ્યું છે. સાવરકુંડલાના ગોરડકા ગામે રહેતા બધુભાઈ આપાભાઈ વાળા (ઉ.વ.૬૦) નામના કાઠી વૃધ્ધને મગજની અસ્થિરતા હોય અને જેના કારણે ગઈકાલે ગુડઝ ટ્રેનની હડફેટમાં આવી જતાં તેનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે.

અમરેલીમાં જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા

અમરેલી,તા.૧૩

અમરેલી સીટી પોલીસે મોડી રાતે શાકમાર્કેટ વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા અજીજ ગફાર મેતર, સાજીદ હુશેન પરમાર, સમીર ઈસ્માઈલ અગવલ, યાસીન અબ્દુલ ઘાંચી, સલીમ ઈબ્રાહીમ રાઠોડ સહીતનાં સાત શખ્સોને રૂા ૮૩૩૦ની રોકડ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

પાદરીયામાંથી ૮૭ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

જૂનાગઢ,તા.૧૩

જૂનાગઢ તાલુકાનાં પાદરીયામાં રહેતા નગા સરમણ રબારીનાં મહાનમાં વિદેશી દારૂ હોવાની બાતમીનાં આધારે તાલુકા પી.એસ.આઈ. સહિતનાં સ્ટાફે દરોડો પાડી ત્યાંથી ૮૭ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જયાં નગો રબારી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ૨૬૧૦૦નો દારૂ કબ્જે કરી તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

શુભ દિપાવલી નૂતન વર્ષાભિનંદન
વિક્રમ સવંતના વ્હાલ ભર્યા વધામણા
સાથે નૂતન વર્ષની શુભકામનાઓ
પી.પી. સોજીત્રા (ચેરમેન)
પ્રવિણભાઈ બી. વિરપરા | પરેશ ડી. પંડયા
વા.ચેરમેન | સેક્રેટરી
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-અમરેલી.

JEE/NEET Guj. Med.
Std. 11 Sem. 2 ફ્રી ડેમો ક્લાસ
તા. ૧૭-૧૧-૧૨ તથા ૧૮-૧૧-૧૨
ના રોજ Ph.D. / GATE ક્વોલીફાઇડ શીક્ષકો દ્વારા
GLOBAL EDUCATION ACADEMY

તાલાલા પંથકના પ્રજાજનોને દિપાવલીની શુભકામનાઓ સહ નૂતન વર્ષાભિનંદન

તાલાલા પંથકના ખેડૂતો તથા સરકારી કર્મચારી પરીવાર- બેંક કર્મચારી પરીવાર- આગાખાન સંસ્થા સ્ટાફ પરીવાર- આદીવાસી મહીલા સંઘ પરીવાર સહીત તમામ પ્રજાજનોને નવલુ નૂતન વર્ષ સર્વત્ર રીતે પ્રગતીકારક બને અને આવતા વર્ષે મેઘરાજા મન મુકી વરસી ગીર પંથક ઉપર મહેરબાની કરી તમામ લોકોની મુશ્કેલી દૂર કરે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના.
લી. હીરબાઈબેન ઈબ્રાહીમભાઈ લોબી
પ્રમુખશ્રી
આદીવાસી મહીલા સંઘ
મુ. જાંબુર, તા. તાલાલા (ગીર)
મો. ૯૯૧૩૦૪૪૮૪૩

Happy New Year
આપ સૌનું નવલું નૂતનવર્ષ સુખમય, સમૃધ્ધીમય નિવડે આ દૈદીપ્યમાન તહેવાર આપના જીવનને ખુશીઓ અને ઉમંગો થી ભરી દે તેવી શુભકામનાઓ...
ડો.રામભાઈ સોલંકી
ઉપપ્રમુખ શ્રી અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.
યાદવ કેરીયર્સ પ્રા.લી

શુભ દિપાવલી....નુતન વર્ષાભિનંદન..
નવલા વર્ષનુ સુપ્રભાત આપને તથા આપના પરિવારને સફળતા, સુખ, આનંદ, સંતોષ આપનારૂ બની રહે તેવી અનેક શુભકામના સહ
શુભ દિપાવલી......નુતન વર્ષાભિનંદન......
શુભેચ્છક
કેશોદવાલા ગૃપ ઓફ કાં.
★ ઇકબાલ કેશોદવાલા ★ નદીમ કેશોદવાલા
★ સીદીક કેશોદવાલા ★ બિલાલ કેશોદવાલા
જી.આઇ.ડી.સી., વેરાવળ
મો : ૯૮૨૫૨ ૨૧૨૫૦
૯૮૨૫૨ ૨૧૨૫૧

With Best Compliments From:
ADITYA BIRLA NUVO
RAY ONE
INDIAN RAYON - A UNIT OF ADITYA BIRLA NUVO LTD.
Manufacturers of
Viscose Filament Yarn, Sulphuric Acid, Carbon di Sulphide, Anhydrous Sodium Sulphate
First VFY Plant in India having ISO-9001:2000, ISO-14001:2004, OHSAS-18001:2007, & SA-8000:2001 Certifications
Also Manufacturers of
CAUSTIC SODA LYE and FLAKES, CHLORINE, HYDROCHLORIC ACID, COMPRESSED HYDROGEN, SODIUM SUPHIDE AND SODIUM HYPOCHLORITE
WE are COMMITTED for :
TOTAL SATISFACTION to CUSTOMERS;
BEST and CONSISTENT QUALITY PRODUCTS at COMPETETIVE COST.
Our Mission
To maintain clean, safe and pollution free environment.
INDIAN RAYON - A UNIT OF ADITYA BIRLA NUVO
VERAVAL - 362 266 (Gujarat)
e-mail:irilveraval@adityabirla.com
Website : www.adityabirla.com

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1388/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk1388/page/n2/mode/1up

2012-11-14 -Satpanth -Protest against religious conversion -Gujarat Samachar (1388)

જૂનાગઢમાં દિવાળીના દિવસે મહાલક્ષ્મી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા હતાં. (તસ્વીરઃ હરેશ સોની)

પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપીને

જામનગરમાં મહિલાનું અપહરણ કરીને ભાણેજે ગુજારેલો બળાત્કાર

જામનગર, તા.૧૩

જામનગરના કિશાન ચોકમાં રહેતી મહિલાનું તેણીના જ ભાણેજે અપહરણ કરીને કારમાં લઈ જઈ અવારનવાર જુદા જુદા સ્થળોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.

ખરાબ કૃત્યના ત્રણ માસ બાદ મહિલાએ અરજી કરતા પોલીસે ફરિયાદ નોંધીને હાથ ધરેલી કાર્યવાહી

બનાવની મળતી માહિતી અનુસાર જામનગરના કિશાન ચોકમાં જોલીયા પીરની દરગાહ પાસે રહેતા શેરબાનુ નામની પરણીત મહિલા તેણીના પુત્ર સાથે તેના ઘર પાસેથી જતી હતી તે દરમ્યાન પ્રોલમાં રહેતો તેણીનો ભાણેજ અફઝલશા યાકુબશા શાહમદાર ફકીર નામનો શખ્સ મારૂતી કારમાં બેસાડી અપહરણ કરી ગયો હતો. બાદમાં મહિલાને પ્રોલમાં જુદા જુદા સ્થળોએ લઈ જઈ પુત્રને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. બનાવના ત્રણ માસ બાદ મહિલાએ તેણીના ભાણેજ અફઝલશા ફકીર વિરૂધ્ધ જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી. જેના આધારે પોલીસે અફઝલશા વિરૂધ્ધ અપહરણ અને બળાત્કારની ફરીયાદ નોંધી મહિલાને તબીબી પરિક્ષણ માટે હોસ્પીટલમાં મોકલી આરોપીની ધરપકડ માટેની તજવીજ આરંભી હતી.

સાવરકુંડલામાં આચારસંહિતાનો સરેઆમ ઉલાળીયો

કોંગ્રેસનાં અગ્રણીએ સ્નેહમિલન યોજીને કર્યા ચૂંટણીલક્ષી ભાષણો

અમરેલી, તા.૧૩

સાવરકુંડલાના એક કોંગી અગ્રણીએ બે દિવસ પહેલાં જ અહીંની પટેલવાડી ખાતે ખેતમજુર હિતરક્ષક સમિતિનાં નેજા તળે સ્નેહમિલન કાર્યક્રમ યોજી ચૂંટણીલક્ષી ભાષણો કરી જનમેદનીને સંબોધી આચારસંહિતાનો ઉલાળીયો કરી નાખતા ભાજપ છાવણીમાં સન્નાટો પ્રસરી જવા પામે છે અને અધીકારીઓ અંધારામાં રહી ગયાનું જાણવા મળેલ છે.

ખેતમજુર હિતરક્ષક સમિતિનાં ઓઠા તળે યોજાયેલા સમારોહથી અજાણ સ્થાનિક અધિકારીઓ પણ અંધારામાં રહી ગયા

સાવરકુંડલાના પીઠવડીના ઉદ્યોગપતિ અને પૂર્વ ધારાસભ્ય સ્વ. મનુભાઈ પીઠવડીવાળાનાં ભત્રીજા દકુભાઈ બાલધા આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે, ત્યારે આ કોંગી અગ્રણીએ દિપાવલીના તહેવાર નિમિત્તે સાવરકુંડલાની પટેલવાડી ખાતે ખેતમજુર હિતરક્ષક સમિતિનાં નેજા તળે વિરાટ સ્નેહમિલન બોલાવેલું અને સેંકડો લોકોએ ભોજન લીધું હતું. આ સ્નેહમિલનના નેજા તળે ચૂંટણીલક્ષી ભાષણો કરી જનમેદનીને સંબોધવામાં આવી હતી અને તાજેતરમાં ભાજપના ધારાસભ્ય કાળુભાઈ વિરાણી સાથે તેની સગી દિકરીએ કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસની માંગ કરવામાં આવી હતી. ભાજપનું દેવાળુ કાઢવાની વાત કરી હતી. આ તમામ ઘટનાઓથી સ્થાનિક અધિકારીઓ અંધારામાં રહ્યા હતા અને ભાજપ છાવણીમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.

અમદાવાદ નજીકના પિરાણા સ્થિત

સતપંથ સંસ્થાનમાં ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ સામે આક્રોશ

જૂનાગઢ,તા.૧૩

અમદાવાદ નજીકના પિરાણા સ્થિત સતપંથ સનાતન સંસ્થાન પ્રેરણાપીઠનાં સાનિધ્યમાં હિન્દુ ધર્મ વિરૂધ્ધ ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ હિન્દુ ધર્મનાં નામો પર પ્રપંચ થઈ રહ્યો હોવાનો આક્ષેપ ભારત સાધુ સમાજે કર્યો છે. આગામી સમયમાં અહીં યોજાનારા સંત સંમેલનમાં કોઈ સાધુ-સંતોએ ભાગ ન લેવા આહવાન કરાયું છે.

આગામી સમયમાં યોજાનાર સંત સંમેલનમાં કોઈ સાધુ સંતોએ ભાગ ન લેવા ભારત સાધુ સમાજનું આહ્વાન

આ અંગે ભારત સાધુ સમાજનાં પ્રમુખ ગોપાલાનંદજીબાપુએ જણાવ્યું છે કે, ઘણા વર્ષોથી સતપંથ ધર્મનાં પ્રચારકો હિન્દુ સંસ્કૃતિના નામ આચાર તેમજ હિન્દુ ધર્મના સાહિત્યનાં ઉપયોગ કરી સમગ્ર હિન્દુ સમાજને ભુમિત કરી ઈસ્લામ ધર્મ સ્વીકાર કરવાની છેતરામણી પ્રવૃત્તી કરી રહ્યાં છે. અને ભોળીપ્રજા આ કચકચથી પ્રભાવિત થઈ રહી છે. સતપંથનાં કુચક્રનો વિરોધ કરવા વાળા સંતોથી બચવા અને હિન્દુ સમાજનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે સમયે સમય પર હિંદુ સંમેલન પણ બોલાવે છે. આવા પ્રભાવથી પિરાણાજતા લોકોને ખબર પડતી નથી કે આ સતપંથ સંસ્થા હિન્દુની છે કે, મુસલમાનની? આવી ભ્રામક જાળ પથરાયેલી છે. આગામી તા.૧૭,૧૮, અને ૧૯ના પિરાણા ખાતે દેશભરનાં પ્રતિષ્ઠીત સાધુ સંતોનું સંમેલન યોજાનાર છે. તેમાં સાધુ સંતોએ ન જવા ભારત સાધુ સંતોને ભારત સાધુ સમાજે ચિમકી આપી છે.

જૂનાગઢમાં દિવાળીના પાવન દિવસે મહાલક્ષ્મી મંદિરે ભકતોની ભીડ

જૂનાગઢ, તા. ૧૩

જૂનાગઢમાં આજે દિવાળી નિમિત્તે મહાલક્ષ્મી મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં અને વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો લાગી હતી.

વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે લાગેલી ભાવિકોની લાંબી કતારો

જૂનાગઢમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવા, રંગોળી કરવી એ ઉપરાંત શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી માતાજીના દર્શન કરવાનું આગવું મહત્વ છે. આજે દિવાળી નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા અને છેક સાંજ સુધી ભાવિકોનો પ્રવાહ અવિરત મંદિર તરફ વહેતો રહ્યો હતો. માતાજીના દર્શન માટે લોકોની લાંબી કતારો લાગી હતી. મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડતા પંચહાટડી ચોક, મહાલક્ષ્મી સ્ટ્રીટ, દાણાપીઠ, ઢાલરોડ સહિતના વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી હતી. આમ આજે હજારો ભાવિકોએ મહાલક્ષ્મી માતાજીના દર્શન કરી ધન્યતાનો અહેસાસ વ્યકત કર્યો હતો.

જામનગરમાં દારૂનો જથ્થો લઈને નીકળેલા

સસ્પેન્ડ પોલીસમેનને પકડવા જતાં ફોજદાર કાર સાથે ૩૦ ફૂટ ઢસડાયા

જામનગર,તા.૧૩

જામનગરમાં દારૂનો જથ્થો લઈને નીકળેલા સસ્પેન્ડ પોલીસમેનને પકડવા જતાં ફોજદાર કાર સાથે ૩૦ ફૂટ સુધી ઢસડાયા હતા અને ઈજા પહોંચી હતી. ફિલ્મીઢબે તેમણે બુટલેગર પોલીસમેની કારનું સ્ટયરીંગ પકડી રાખ્યું હતું. જો કે એ પોલીસમેન નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

ફિલ્મી ઢબે કારનું સ્ટીયરીંગ પકડી રાખનાર ફોજદાર ઘાયલ, બુટલેગર પોલીસમેન નાસી છૂટવામાં સફળ

આ અંગેની મળતી માહિતી મુજબ, જામનગરના ગ્રામ્ય ડીવાય.એસ.પી. કચેરીમાં રીડર પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા જી.એન.વાઘેલા સોમવારાં રાત્રીનાં સમયે બિરલ બાગ પાસે પેટ્રોલંગમાં ફરજ પર હતા. ત્યારે ભારે શંકાસ્પદ કાર પસાર થતાં આંતરી પુછપરછ કરતા ચાલક દિગુભા જાડેજા અને દારૂનાં કેસમાં પોલીસ વિભાગમાંથી સસ્પેન્ડ કરાયા હોવાનું જણાવ્યું હતું. પી.એસ.આઈ.ને શંકા જતા કારમાં દારૂનો જથ્થો હોવાથી કાર પોલીસ મથકે લેવાનું જણાવતા ચાલક દિગુભા એ બોલાચાલી કરી હતી અને પી.એસ.આઈ. વાઘેલાએ કારનું સ્ટીયરીંગ પકડી રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાર હંકારી મુકી હતી.

જેથીસ્ટયરીંગ પકડેલા પી.એસ.આઈ. વાઘેલા કારમાં ત્રીસ ફુટ સુધી ઢસડાયા હતા અને બાદમાં ઢસડાયેલા પી.એસ.આઈ.ને ઈજા પહોંચતા કાર ચાલક દિગુભા જાડેજા કાર લઈ નાસી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્તે કંટ્રોલમાં જાણ કરી હતી અને બાદમાં તેને અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણે સસ્પેન્ડ પોલીસ કર્મી દિગુભા જાડેજા વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને ઈજા પહોંચાડયાની ફરીયાદ નોંધાવી છે. દિગુભા વિરૂધ્ધ દારૂના અનેક કેસો છે. તેમજ પાસામાં પણ અટકાયત થઈ હતી. પોલીસે દિગુભાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.

ઉનાના કંસાટી નજીક ત્રિપલ અકસ્માતમાં ૧૧ વ્યક્તિને ઈજા

ઉના,તા.૧૩

ઉનાના કંસાટી ગામ પાસે છકડા રીક્ષા સાથે મોટરસાયકલ અથડાતા સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ૧૧ વ્યક્તિઓને નાની મોટી ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયાં હતાં.

મજૂરોને ભરીને આવી રહેલી છકડો રિક્ષા સાથે બે મોટર સાયકલો અથડાતા સર્જાયેલી દુર્ઘટનાં

ઉના શહેરથી કંસારા ગામ જતા રોડ ઉપર ઉના તાલુકાનાં ભાચા ગામનાં અશ્વિન રામજીભાઈ કુંભાર ડાંગોદરા તેમની પત્ની સંગીતાબેન, ભારતીબેન સામતભાઈ ડોગોદરા સાથે ઉનાથી દિવાળી સબબ ખરીદી કરી પરત ત્રિપલ સવારીમાં જતા હતા ત્યારે સામેથી ધોકડવા તરફથી મજુરોને નાથળ મુકવા જતી છકડો રીક્ષા સાથે ધડાકા ભેર અથડાતાં ત્રિપલ સવારી વાળું મોટર સાયકલ રોડ ઉપર ફંગોળાઈ પડતાં બીજી બાઈક જતી હતી તેની સાથે અથડાતા તે પણ પડી ગયું હતું. ઘડીક વારમાં રોડ ચીસા ચીસથી ગાજી ઉઠયો હતો. જેમાં ઈજા પામનાર દયાબેન કરશનભાઈ રૂપાબેન કરશનભાઈ, મયુરીબેન જીતુભાઈ રે. ભાચા ત્થા છકડા રીક્ષામાં બેઠેલા શ્રીમીક મનીષાબેન કાનાભાઈ (રે. સીલોજ) દિપાબેન ભાણાભાઈ નાનજીભાણાભાઈ નયનાબેન સાર્દુલ (મોટા ડેસર) ત્થા સપના બ`ન સાર્દુલભાઈ (રે. નાથળ) સહિત અગીયાર જણાને ઈજાઓ થતાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ઉના દવાખાને સારવાર માટે ખસેડયાં હતાં. જેમાં અશ્વીનભાઈ ડાંગોદરા, રૂપાબેન બે દવાખાના સ્થીત ગંભીર હોય વધુ સારવાર માટે જુનાગઢ ખસેડેલ છે.

વાહનોની ઝડપથી ઉત્પન્ન કૃત્રિમ પવનમાંથી થતું વીજ ઉત્પાદન

જૂનાગઢ, તા. ૧૩

તાજેતરમાં જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ પીટીસી ઝોન કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં જૂનાગઢની એક પીટીસી કોલેજની તાલીમાર્થીઓએ રસ્તા પર પસાર થતાં વાહનોની ઝડપથી ઉત્પન્ન કૃત્રિમ પવનમાંથી વીજ ઉત્પાદન તેનો ઉપયોગ અને ફાયદાની કૃતિ રજૂ કરી હતી જે જિલ્લા કક્ષાએ પ્રથમ આવી હતી. હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે.

જૂનાગઢની વિજ્ઞાન મેળાની કૃતિ રાજય કક્ષાએ પહોંચી

જીસીઈઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢના ઉપક્રમે જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ પીટીસી ઝોન કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત મહિલા પીટીસી કોલેજના તાલીમાર્થી મૌસમી ગરેનીયા અને રાજલબે ભમ્મર અને ભાવનાબેન વસરાએ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા રવજીભાઈ પીઠવાના માર્ગદર્શન હેઠળ રસ્તા પર પસાર થતાં વાહનોની ઝડપનાં લીધે વેગથી ઉત્પન્ન થતાં કૃત્રિમ પવનમાંથી વીજ ઉત્પાદન, ઉપયોગ અને તેના ફાયદા અંગેની કૃતિ રજૂ કરી હતી જે કૃતિ પ્રથમ સ્થાને પહોંચી હતી. હવે આ કૃતિ આગામી રાજય કક્ષાના ગણિત- વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે.

સીમાંકનના કારણે ભાજપના ફળદુથી કોંગ્રેસના ઉંધાડની બેઠકો વિલીન

સૌરાષ્ટ્ર-કચ્છમાં સીમાંકનથી બદલાતા રાજકીય સમીકરણઃ આઠ બેઠકો રદ્દ

રાજકોટ, મંગળવાર

સૌરાષ્ટ્ર-કચ્છમાં સીમાંકનને કારણે ભૌગોલિકની સાથોસાથ રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાઈ ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ફળદુથી લઈને કોંગ્રેસના બાવકુભાઈ ઊંધાડ માટે આ ચૂંટણીમાં ઉમેદવારી કયાં નોંધાવવી તે પ્રશ્ન સર્જાયો છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં વિધાનસભાની ૫૮ બેઠકો હતી, જેમાં નવા સીમાંકનથી ૮ બેઠકો વિલીન થઈ છે, જ્યારે ૪ નવી બેઠકો સર્જાતા કુલ ૫૪ બેઠકો છે.

રદ થયેલી બેઠકો કોણ જીત્યુ હતુ?

હળવદ	ભાજપ	માળિયાહાટિના	ભાજપ
ભાણવડ	ભાજપ	બાબરા	કોંગ્રેસ
પ્રોલ-જોડીયા	કોંગ્રેસ	મુન્દ્રા	ભાજપ
ઉપલેટા	ભાજપ	ઘોઘા	ભાજપ

સીમાંકનની સર્વાધિક અસર જામનગર જિલ્લામાં થઈ છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુની બેઠક કાલાવડ આગામી ચૂંટણીમાં અનામત જાહેર થતા ફળદુ માટે મુંઝવણ સર્જાઈ છે.

જામનગર જીલ્લામાં ૨૦૦૭ની ચૂંટણીમાં જામનગર, જામનગર ગ્રામ્ય, ભાણવડ, પ્રોલ, જોડિયા, કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, દ્વારકા બેઠકો હતી. તેમાં નવા સીમાંકન બાદ ભાણવડ અને પ્રોલ-જોડિયાની બેઠકો ઘટી છે તેની સામે જામનગર શહેરમાં એક બેઠક વધતા શહેરની ત્રણ બેઠક થઈ છે. જીલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી જેવા ઉમેદવારોની ક્ષમતા કસોટીની એરણ પર છે.

કચ્છમાં મુન્દ્રા બેઠક ભાજપનો ગઢ ગણાય છે, ૧૫ વર્ષથી આ બેઠક ભાજપ પાસે છે. મુન્દ્રા અનામત બેઠક હતી જે હવે માંડવીમાં ભળી જતાં અહીં ભાજપ અને કોંગ્રેસ બંને માટે નવા સમીકરણો સર્જાયા છે. આગામી ચૂંટણીમાં ગાંધીધામ (અનામત) નવી બેઠક જાહેર થઈ છે. અગાઉ આ વિસ્તાર અંજારનો હિસ્સો હતો. ગાંધીધામ અનામત જાહેર થતાં મુળ ગાંધીધામના અને અંજાર બેઠક ઉપરથી જીતેલા ભાજપના ધારાસભ્ય નિમાબેન આચાર્ય માટે જબરી વિમાસણ સર્જાઈ છે. ગયા વખતે ભૂજમાંથી જીતેલા મંત્રી વાસણભાઈ આહીરની

નજર આ વખતે તેના હોમ ટાઉન અંજાર ઉપર છે, ત્યારે કોંગ્રેસ પણ નવી સ્થિતિમાં નવી ગણતરી માંડી રહી છે. અમરેલી જિલ્લામાં કોંગ્રેસ હસ્તકની એકમાત્ર બેઠક બાબરા આ વખતે સીમાંકનમાં વિલીન થઈ ગઈ છે. બાબરા, વડીયા અને કુંકાવાવ વિસ્તાર ધરાવતી અને તેનો પહેલો પહેલો અક્ષર લો તો બા-વ-કુ થાય એ સંયોગ ગણો તો આ બેઠક કોંગ્રેસના બાવકુભાઈ ઊંધાડે જીતેલી હતી. હવે બાબરા બેઠકનો સમાવેશ લાઠીમાં થઈ ગયો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને માટે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ૫૫ હજાર મતદારોનો ઉમેરો થયો છે. જેમાં અસરકારક ગણાય તેવા ૪૮ હજાર લેઉવા પટેલ મતદારો છે, જેને કેશુભાઈનું ફેકટર પણ અસર કરી શકે તેમ છે. કોંગ્રેસ અમરેલીમાં

સૌરાષ્ટ્રઃ રાજકારણને બદલાવતી ભૂગોળ

બાવકુભાઈને લડાવવા માગતી હતી પરંતુ છેલ્લી સ્થિતિ મુજબ લાઠી બેઠક ઉપરથી જ તેને લડાવાશે જ્યારે ભાજપમાં હજુ વર્તમાન ધારાસભ્ય સહિત ત્રણેક દાવેદારો છે.

સૌરાષ્ટ્રમાં સોરઠ ઉપર કોંગ્રેસની સર્વાધિક પક્કડ ગણાય છે. અહીં ૯માંથી ૩ બેઠકો કોંગ્રેસને મળેલી છે. આગામી ચૂંટણીમાં ભાજપના ગઢ જેવી માળિયા હાટીના બેઠક રદ થઈ છે અને આ બેઠકનો મોટો હિસ્સો માંગરોળ બેઠકમાં ભળ્યો છે. માંગરોળ બેઠક ઉપર ભાજપને માત્ર ૩ હજાર મતની લીડ મળી હતી.

કોળી અને મુસ્લિમ મતદારોની નિર્ણાયક ૭૦ હજારથી વધુની સંખ્યા ધરાવતા માંગરોળની પાલિકામાં કોંગ્રેસનું શાસન છે. તાલુકા પંચાયતમાં પણ ભાજપ એકાદ બેઠકના વધારા સાથે હાલકડોલક છે ત્યારે નવા પરિબળોના આધારે ઉમેદવારી અંગે ગણતરી મંડાઈ રહી છે. અહીં મતદારોનો ઝોંક હંમેશા અકળ રહે છે. છેલ્લી પાંચ ચૂંટણીમાં ૩ વખત કોંગ્રેસ, ૨ વખત ભાજપની જીત થઈ છે.

પાંચ હજારથી પણ ઓછી સરસાઈથી ૨૦૦૭માં ભાજપે જીતેલી ઉપલેટા બેઠક આ વખતે રદ થઈ છે. આ બેઠક ગત ચૂંટણીમાં

જિલ્લો	જીલ્લામાં રદ થયેલી બેઠક	જીલ્લામાં નવી બેઠકો
જામનગર	ભાણવડ-પ્રોલ-જોડીયા	જામનગર ગ્રામ્ય
રાજકોટ	ઉપલેટા	રાજકોટની ૧માંથી ૨ બેઠક
જૂનાગઢ	માળિયા(હા)	
અમરેલી	બાબરા	
સુરેન્દ્રનગર	હળવદ	
કચ્છ	મુન્દ્રા	ગાંધીધામ (અનામત)
ભાવનગર	ઘોઘા	ભાવનગર ગ્રામ્ય
પોરબંદર	-	-

એનસીપીના જમનાદાસ ગેડીયા લડયા હતા જેને ૩૨ હજારથી વધુ મતો મળ્યા હતાં. જુના સીમાંકન પ્રમાણે ઉપલેટાની બેઠકમાં તાલુકાના બાવન ગામ અને ધોરાજી તાલુકાના અગીયાર ગામોના એક લાખ ચાલીશ હજાર જેવા મતદારોમાં મુખ્ય જ્ઞાતિઓ જેવી કે કડવા પટેલ ૨૪૦૦૦ લેઉઆ પટેલ, ૧૮૦૦૦ આહેર, ૧૫૦૦૦ મુસ્લીમ, ૧૫૦૦૦ દલીતો, ૧૨૦૦૦ કોળી ૧૦૦૦૦, રબારી ૬૦૦૦ ક્ષત્રીય ૬૦૦૦ અને બાકીના ઈતર મતો હતા. નવા સીમાંકનમાં પણ લેઉઆ અને કડવા બે મુખ્ય જ્ઞાતિના મતોનું મોટાપાયે ધ્રુવિકરણ થશે ત્યારે મુસ્લીમોના ૩૫૦૦૦ અને દલીતોના ૨૮૦૦૦ જેવા મતો અને ઈતર સમાજના મતો નિર્ણાયક સાબીત થશે. ઝાલાવાડ (સુરેન્દ્રનગર જિલ્લા)માં આ વખતે હળવદ બેઠકનો અડધો ભાગ ચોટીલામાં અને અડધો ભાગ ધ્રાંગધ્રામાં વિલીન કરી દેવાયો છે જેના કારણે હળવદના વર્તમાન ધારાસભ્ય દેવજીભાઈ ફતેપરાને બીજી બેઠક શોધવાની નોબત આવી છે. નવા સીમાંકનથી જ્ઞાતિના સમીકરણો બદલાઈ ગયા છે.

ભાજપની જીતેલી ૬ અને કોંગ્રેસે જીતેલી ૨ બેઠકો વિલીન થઈ: નવી ચાર બેઠકો સાથે જ્ઞાતિના સમીકરણોમાં પણ ફેરફાર

કુચિડાદડ પાસે કાર હડફેટે બાઈક ચાલક પ્રૌઢનું મોત

રાજકોટ, મંગળવાર

રાજકોટ નજીક કુચિયાદડ ગામે પહેલાં કારખાનાં પાછળથી ગામ તરફ જતાં રસ્તે આજે બપોરે બાઈક લઈને વી રહેલા વલ્લભભાઈ જેઠાભાઈ દેસાઈ(૫૦, રહે. કુચિયાદડ) નામનાં પટેલ ગૃહસ્થને સામેથી આવતી વેગન-આર કારનાં ચાલકે હડફેટમાં લેતાં ગંભીર ઈજાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

ચોરડીના વસંતબા ગુરૂ આશ્રમમાં કાલે સમાધિ મંદિર સમારોહ

રાજકોટ, મંગળવાર

ગોંડલ પાસેનાં ચોરડી ગામે આવેલા વસંતબા ગુરૂ આશ્રમમાં તા.૧૫.૧૧ ગુરૂવારનાં રોજ અહીના બ્રહ્મલીન સંત જશુરામ મહારાજના ચેતન સમાધી મંદિર બાંધકામ પુર્ણ થતા ગુરૂમાતા પુ. વસંતબા માતાજી, તથા બંદરા આશ્રમના મહંત ગોરધનબાપા, તથા સતાધારથી વજિયબાપુ ગુરૂ બોદરા જીવરાજબાપુ વગેરેના હસ્તે દિપ પ્રાગટય કરી શાસ્ત્રોકત વિધિવત કરી ખુલ્લું મુકવામાં આવશે. તેમજ જસવંત જયોત પ્રકાશ ના સંતો ભકતોના સ્નેહમિલન નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

જૂનાગઢમાં ૨૦મીએ સિનીયર સિટીઝન મંડળની બેઠક

જૂનાગઢ,તા.૧૩

જૂનાગઢનાં સિનીયર સિટીઝન મંડળની માસિક મિટીંગ તથા નૂતનવર્ષ સ્નેહમિલન આગામી તા.૨૦નાં સાંજે ૫ વાગ્યે, માંગનાથ રોડ, જૂનાગઢ ખાતે યોજાશે.

સંક્ષિપ્ત સમાચારો

પ્રભાસપાટણનાં વિશ્વકર્મા મંદિરે આજે અન્નકૂટ ઉત્સવ

વેરાવળઃ પ્રભાસપાટણમાં ગુર્જર સુતાર જ્ઞાતિ સંચાલિત શ્રી વિશ્વકર્મા મંદિરે તા.૧૪મીએ બુધવારે અન્નકૂટ ઉત્સવ યોજાશે.

જૂનાગઢમાં આજે બર્ડાઈ બ્રહ્મસમાજનું સ્નેહમિલન

જૂનાગઢઃ બર્ડાઈ બ્રહ્મસમાજ દ્વારા નૂતનવર્ષ નિમીતે તા. ૧૪ના સાંજે ૪થી ૬, જ્ઞાતીની વાડી ખાતે સમાજના ભાઈ-બહેનોનું સ્નેહમિલન યોજાશે. જેમાં જ્ઞાતીજનોએ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

જૂનાગઢમાં સમસ્ત લેઉવા પટેલ સમાજનું સ્નેહમિલન

જૂનાગઢઃ મહાનગરમાં વસતા લેઉવા પટેલ સમાજનું નવા વર્ષનું સ્નેહમિલન તા.૧૪ના સવારે ૮.૩૦ વાગ્યે દોમડીયાવાડી ખાતે યોજાશે. જેમાં દરેક જ્ઞાતીજનોએ ઉપસ્થિત રહેવા સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજ દોમડીયા વાડીના પ્રમુખ દ્વારા જણાવાયું છે.

વડીયા ગીરમાં કાલે કસુંબલ લોકડાયરો

માળીયા હાટીના તાલુકાના વડીયા ગીરમાં તા. ૧૫ને ભાઈબીજને ગુરૂવારે નવા પ્લોટ ખાતે રાત્રે ૯ કલાકે વડીયાના રામદેવપીર મહારાજ યુવક મંડળ તથા વડીયા ગામ સમસ્ત ગામ લોકોના સાથ સહકારથી કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

સમાચારો ટૂંકાણમાં

માલગાડી હેઠળ આવી જતાં ગોરડકાના વૃધ્ધનું મોત

અમરેલી, તા.૧૩

સાવરકુંડલામાં ગોરડકા ગામના અસ્થિર મગજના વૃધ્ધનું ગુડઝ ટ્રેન હડફેટે આવી મોત નિપજ્યું છે. સાવરકુંડલાના ગોરડકા ગામે રહેતા બધુભાઈ આપાભાઈ વાળા (ઉ.વ.૬૦) નામના કાઠી વૃધ્ધને મગજની અસ્થિરતા હોય અને જેના કારણે ગઈકાલે ગુડઝટ્રેનની હડફેટમાં આવી જતાં તેનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે.

અમરેલીમાં જુગાર રમતાં સાત જુગારીઓ ઝડપાયા

અમરેલી,તા.૧૩

અમરેલી સીટી પોલીસે મોડી રાતે શાકમાર્કેટ વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા અજીજ ગફાર મેતર, સાજીદ હુશેન પરમાર, સમીર ઈસ્માઈલ અગવલ, યાસીન અબ્દુલ ઘાંચી, સલીમ ઈબ્રાહીમ રાઠોડ સહીતનાં સાત શખ્સોને રૂા ૮૩૩૦ની રોકડ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

પાદરીયામાંથી ૮૭ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

જૂનાગઢ,તા.૧૩

જૂનાગઢ તાલુકાનાં પાદરીયામાં રહેતા નગા સરમણ રબારીનાં મહાનમાં વિદેશી દારૂ હોવાની બાતમીનાં આધારે તાલુકા પી.એસ.આઈ. સહિતનાં સ્ટાફે દરોડો પાડી ત્યાંથી ૮૭ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જ્યાં નગો રબારી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ૨૬૧૦૦નો દારૂ કબ્જે કરી તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

શુભ દિપાવલી નૂતન વર્ષાભિનંદન
વિક્રમ સવંતના વ્હાલ ભર્યા વધામણા સાથે નૂતન વર્ષની શુભકામનાઓ
પી.પી. સોજીત્રા (ચેરમેન)
પ્રવિણભાઈ બી. વિરપરા વા.ચેરમેન | પરેશ ડી. પંડયા સેક્રેટરી
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-અમરેલી.

JEE/NEET Guj. Med.
Std. 11 Sem. 2 ફ્રી ડેમો કલાસ
તા. ૧૭-૧૧-૧૨ તથા ૧૮-૧૧-૧૨
ના રોજ Ph.D. / GATE ક્વોલીફાઈડ શીક્ષકો દ્વારા
GLOBAL EDUCATION ACADEMY

તાલાલા પંથકના પ્રજાજનોને દિપાવલીની શુભકામનાઓ સહ નૂતન વર્ષાભિનંદન

તાલાલા પંથકના ખેડૂતો તથા સરકારી કર્મચારી પરીવાર- બેંક કર્મચારી પરીવાર- આગાખાન સંસ્થા સ્ટાફ પરીવાર- આદિવાસી મહીલા સંઘ પરીવાર સહીત તમામ પ્રજાજનોને નવલુ નૂતન વર્ષ સર્વત્ર રીતે પ્રગતીકારક બને અને આવતા વર્ષે મેઘરાજા મન મુકી વરસી ગીર પંથક ઉપર મહેરબાની કરી તમામ લોકોની મુશ્કેલી દૂર કરે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના.
લી. હીરબાઈબેન ઈબ્રાહીમભાઈ લોબી
પ્રમુખશ્રી
આદીવાસી મહીલા સંઘ
મુ. જાંબુર, તા. તાલાલા (ગીર)
મો. ૯૯૧૩૦૪૪૮૪૩

Happy New Year
આપ સૌનું નવલું નૂતનવર્ષ સુખમય, સમૃધ્ધીમય નિવડે આ દૈદીપ્યમાન તહેવાર આપના જીવનને ખુશીઓ અને ઉમંગો થી ભરી દે તેવી શુભકામનાઓ...
ડો.રામભાઈ સોલંકી
ઉપપ્રમુખ શ્રી અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.
યાદવ કેરીયર્સ પ્રા.લી

શુભ દિપાવલી....નુતન વર્ષાભિનંદન...
નવલા વર્ષનુ સુપ્રભાત આપને તથા આપના પરિવારને સફળતા, સુખ, આનંદ, સંતોષ આપનારૂ બની રહે તેવી અનેક શુભકામના સહ
શુભ દિપાવલી......નુતન વર્ષાભિનંદન......
:::::::: શુભેચ્છક ::::::::
કેશોદવાલા ગૃપ ઓફ કું.
★ ઇકબાલ કેશોદવાલા ★ નદીમ કેશોદવાલા
★ સીદીક કેશોદવાલા ★ બિલાલ કેશોદવાલા
જી.આઇ.ડી.સી., વેરાવળ
મો : ૯૮૨૫૨ ૨૧૨૫૦
૯૮૨૫૨ ૨૧૨૫૧

With Best Compliments From:
ADITYA BIRLA NUVO
RAY ONE
INDIAN RAYON – A UNIT OF ADITYA BIRLA NUVO LTD.
Manufacturers of
Viscose Filament Yarn, Sulphuric Acid, Carbon di Sulphide, Anhydrous Sodium Sulphate
First VFY Plant in India having ISO-9001:2000, ISO-14001:2004, OHSAS-18001:2007, & SA-8000:2001 Certifications
Also Manufacturers of
CAUSTIC SODA LYE and FLAKES, CHLORINE, HYDROCHLORIC ACID, COMPRESSED HYDROGEN, SODIUM SUPHIDE AND SODIUN HYPOCHLORITE
WE are COMMITTED for :
TOTAL SATISFACTION to CUSTOMERS; BEST and CONSISTENT QUALITY PRODUCTS at COMPETETIVE COST.
Our Mission
To maintain clean, safe and pollution free environment.
INDIAN RAYON – A UNIT OF ADITYA BIRLA NUVO
VERAVAL – 362 266 (Gujarat)
e-mail:irilveraval@adityabirla.com
Website : www.adityabirla.com

realpatidar.com